



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૦/૦૬/૨૦૧૯ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૪૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૫ કેસ કરી, ૪૬ વ્યક્તિઓને ઝડપી, ૨૨૩ લીટર દેશી દારૂ, ૨૬ બોટલ ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૦૩ કેસ કરી ૧૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૯,૨૯૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૪૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

વિશ્વાસઘાત અને છેતરપીંડી :-

સમાચાર યાદી નં.૧૦૪૭/૧૯

વાડજ : જશીબેન જીણાભાઈ પટેલ (ઉ.વ.૫૦)(રહે.કાશ્મીરા મહાદેવની ચાલી જુના વાડજ) એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૦૬/૨૦૧૯ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે જુના વાડજ ખાતે આવેલ પોતાના “વિનય કિરણ સ્ટોર” ખાતે હાજર હતા દરમ્યાન એક અજાણી સ્ત્રીએ આવીને જશીબેનને “સરકારી સહાય મળશે તથા વિધવા સહાય મળશે” તેમ કહી જશીબેનને વિશ્વાસમાં લઈ, જુના વાડજ થી રીક્ષામાં બેસાડી સિવિલ હોસ્પિટલ લાવી, “સિવિલ હોસ્પિટલ ખાતે ફોટા પાડવાનું જણાવી” જશીબેન પાસેથી બે બંગડી કિંમત રૂપિયા ૪૫,૦૦૦/- તથા સોનાની ચેઇન કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- મેળવી લઈ, ચુંટણીકાર્ડની ઝેરોક્ષ કઢાવાનું કહી દાગીના લઈ નાસી જઈ જશીબેન સાથે છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.બી.રાજપુત ચલાવે છે.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૧૦૪૮/૧૯

શહેરકોટડા : શૈલેશભાઈ અમરનાથ ભાટીયા (ઉ.વ.૪૩)(રહે. ગુ.હા.બોર્ડ નવરંગ ફ્લેટની બાજુમા બાપુનગર) એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૦૬/૨૦૧૯ રાતના ૯/૦૦ થી તા.૧૯/૦૬/૨૦૧૯ ના કલાક ૯/૦૦ વાગ્યા દરમ્યાન બાપુનગર મહાશક્તિ એસ્ટેટમાં આવેલ “ન્યુ ટેક મેટલ” નામની પોતાની દુકાન ની પાછળની બારીના સળીયા તોડી, અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી, ડ્રોવરમાંથી રોકડ રૂપિયા ૧,૩૭,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.ડી.ચાવડા ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૦૪૯/૧૯

સાબરમતી : મનોજભાઈ રઘુનાથ જયસ્વાલ (ઉ.વ.૪૧)(રહે.છગનલાલ શુશીરામની ચાલી પાંચ બંગલા કૈલાદેવી મંદિરની બાજુમા સાબરમતી) એ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૮/૦૬/૨૦૧૯ રાતના ૯/૪૫ થી ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન ધર્મનગર કૈલાદેવી મંદિર ની બાજુમાં આવેલ પોતાની “કલમ જનરલ સ્ટોર્સ” નામની દુકાનના દરવાજેથી અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, દુકાનમાંથી રોકડ રૂપિયા ૮૧,૫૦૦/- તથા અગત્યના દસ્તાવેજોની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.જે.દેસાઈ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૦૫૦/૧૯

વસ્ત્રાપુર : અંકીત આનંદ ગર્ગ (ઉ.વ.૨૯)(રહે.કલ્યાણ ટાવર આલ્ફાવન મોલ ની સામે વસ્ત્રાપુર લેક ની પાછળ વસ્ત્રાપુર) એ અગમ્ય કારણસર તા.૧૯/૬/૨૦૧૯ ના કલાક ૫/૪૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે કલ્યાણ ટાવર ઉપરથી નીચે પડતુ મુકતા, શરીરે ઇજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યુ હતુ. આ અંગે વસ્ત્રાપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જે.ભાટીયા ચલાવે છે.

રામોલ : શશીપ્રભા ડો/ઓ રવિન્દ્ર રામનરેશ (ઉ.વ.૨૭)(રહે.આઝાદનગર સી.ટી.એમ.મીલની પાછળ, રામોલ) એ અગમ્ય કારણસર તા.૧૯/૦૬/૧૯ બપોરના ૧/૪૫ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટે બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ અંગે રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી અમૃતભાઈ બીજલભાઈ ચલાવે છે.

કાગડાપીઠ : રાજેન્દ્રભાઈ છોટેલાલ કોષ્ટી (ઉ.વ.૬૦)(રહે.કર્ણમૂકતેશ્વર એપાર્ટમેન્ટ, દિવાન બલ્લુભાઈ સ્કુલની બાજુમાં કાંકરીયા) એ તા.૧૯/૦૬/૨૦૧૯ ના કલાક ૫/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે અગમ્ય કારણસર પોતાની જાતે એસિડ પી લેતા સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૯/૦૬/૨૦૧૯ બપોરના ૧૨/૧૦ વાગે ફરજ પરના ડો.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે કાગડાપીઠ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી નટવરભાઈ હરજીભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.